

Date: February 13, 2024

To, BSE LIMITED Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai - 400001

SUB: NEWSPAPER ADVERTISEMENT FOR PUBLICATION OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON DECEMBER 31, 2023.

REF: FRESHTROP FRUITS LIMITED – SECURITY CODE – 530077 – SECURITY ID - FRSHTRP

Dear Sir / Madam,

The Board of Directors at its Meeting held on February 12,2024 has, inter alia, approved the Audited Financial Results of the Company for the quarter and nine months ended on December 31, 2023.

Pursuant to the provisions of Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith Copy of Newspaper clippings of the Audited Financial Results published on February 13,2024 in following newspapers:

- 1. Business Standard, Ahmedabad (English Language)
- 2. Jai Hind, Gujarati

The above information will also be made available on the website of the Company www.freshtrop.com in Investor section.

This is for your information and records.

Thanking You,

Yours faithfully,

FOR, FRESHTROP FRUITS LIMITED

ASHOK MOTIANI MANAGING DIRECTOR

**DIN: 00124470 Encl: As above** 

Sr.



### GILADA FINANCE AND INVESTMENTS LIMITED

CIN: L65910KA1994PLC015981

Regd. Office: #105 R.R Takt, 37 Bhoopasandra Main Road, Bangalore- 560094 Ph:080-40620000(30 Lines) Fax: 080-40620008; E-mail:md@giladagroup.com, Website: www.giladafinance.com

(Standalone Un-audited Financial Results for the Quarter and Nine Months ended on 31st December, 2023) [Regulation 47(1) (b) of the SEBI (LODB) Regulations, 2015].

<u>.</u> .	Particulars	Quarter Ended			Half Year	Year Ended	
SI. No.		31-Dec-2023 (Un-audited)	30-Sep-2023 (Un-audited)	31-Dec-2022 (Un-audited)	31-Dec-2023 (Un-audited)	31-Dec -2022 (Unudited)	31-Mar-2023 (Audited)
1.	Total Income	183.69	158.00	128.62	479.44	348.17	581.48
2.	Total Expenses	103.85	77.26	81.38	260.63	212.76	376.68
3.	Profit/ Loss before Tax	79.84	80.74	47.24	218.81	135.41	204.80
4.	Tax Expenses						
	a) Current tax	20.07	20.35	12.00	55.07	34.00	47.94
	b) Deferred Tax						5.22
5.	Profit for the Period	59.77	60.39	35.24	163.74	101.41	151.64
6.	Equity Share Capital	702.46	702.46	702.46	702.46	702.46	702.46
7.	Earnings Per Share :						
	1. Basic:	0.43	0.43	0.25	1.17	0.72	1.08
	2. Diluted:	0.43	0.43	0.25	1.17	0.72	1.08

Notes:-The above is an extract of the detailed format of Audited Financial Results filed with the Stock Exchanges unde Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Un-audited Financial Results is available on the websites of the Company at www.giladafinance.com and the Stock Exchange at www.bseindia.com For GILADA FINANCE AND INVESTMENTS LTD

Sd/- (Rajgopal Gilada)
Managing Director (DIN: 00307829)

FreshtrÖp

#### FRESHTROP FRUITS LIMITED

CIN: L15400GJ1992PLC018365

Reg. Office: A 603, Shapath IV, S. G. Road, Ahmedabad - 380015 Tel: 079 40307050-57, E-mail: info@freshtrop.com, Website: www.freshtrop.com

Quarter Ended Nine Months Ended Quarter Ended 31.12.2023 31.12.2022 **Particulars** 31.12.2023 (Audited) (Audited) (Unaudited) 2458.89 6.986.94 3.248.71 Total income from operations (net) Net Profit for the period (before tax and exceptional items) -449.03 -616.22 377.63 Net Profit for the period before tax (after exceptional items) -449.03 -616.22 377.63 4725.34 Net Profit for the period after tax (after exceptional items) 6,015.63 207.95 Total Comprehensive Income for the period -8.16-6.6413.94 Profit/Loss for the period after comprehensive income 4717.18 6,008.99 221.89 Equity Share Capita 989.49 989.49 1,068.80 Earning Per Share (Of Rs. 10 each) (after extraordinary items) 60.80 Basic 1.95 Diluted 47.76 60.80

Extract of Audited Financial Results for the Quarter and Nine Months Ended on 31st December, 2023

Notes

(1) The above is an extract of the detailed format of Financial Results for the quarter and nine months ended on 31.12.2023. filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the website of the Stock Exchange i.e. www.bseindia.com and also on the Company's website www.freshtrop.com. The result have been prepared in accordance with the Indian Accounting Standards ("Ind AS") as prescribed under section 133 of the Companies Act, 2013 read with relevant rules issued thereunder.

(2) The above results were reviewed by the audit Committee and were approved and taken on record by the Board of Directors in their meeting held on February 12, 2024.

(3) Revenue From Operations includes Export Incentives.

Place: Ahmedabad

Date: 12.02.2024

(4) Due to disposal of Fresh Fruit unit, the Company has only one segment of activity and hence segment reporting is not applicable to

(5) Due to disposal of Fresh Fruit unit, the financial results to the extent of Statement of Profit & Loss and its resulted impact on earning per share and segment for the quarters ended September 30, 2023 and December 31, 2022, for the nine month ended December 31, 2022 and year ended March 31, 2023, have been restated by excluding figures of fresh fruit unit which have been included under discontinued operations for comparison purposes.

6) Previous Year's figures have been regrouped, reclassified wherever considered necessary

For, Freshtrop Fruits Limited

Ashok Motian **Managing Director**  **BIL INFRATECH LIMITED - IN LIQUIDATION** Regd. Off.: 37/2, Chinar Park, New Town, Rajarhat Main Road, P.O.: Hatiara, Kolkata, 700157, West Bengal

**E-AUCTION** Sale of Corporate Debtor as a Going Concern under the Insolvency

and Bankruptcy Code, 2016 Date and Time of E-Auction: 12" March, 2024 at 11:00 AM to 02:00 PM (With unlimited extension of 10 minutes each)

**SALE NOTICE** 

Notice is hereby given for Sale of "M/s BIL Infratech Ltd- In Liquidation (Corporate Debtor)" as a Going Concern forming part of Liquidation Estate formed by the Liquidator, appointed by the Hon'ble NCLT Kolkata Bench under the Insolvency and Bankruptcy Code, 2016 and the regulations made the

Assets	Reserve Price (Rs. in Crores)	EMD Amount (Rs. in Crores)
Sale of Corporate Debtor as a Going Concern along with all assets including Securities & Financial Assets (Excluding cash/ Bank balance over and above Rs 25.00 Lakh)	Rs 14.37	Rs 1.40

The sale shall be subject to the Terms and Conditions prescribed in the "E-Auction Process Information Document" available at https://nclt.auctiontiger.net and https://bilinfratech.com/ and to the following conditions: 1.It is clarified that, this invitation purports to invite prospective bidders and does not create

sale. Liquidator of M/s BIL Infratech Limited reserves the right to suspend/ abandon cancel/extend or modify process terms and/or reject or disqualify any prospective bidder/bid/offer at any stage of the e-auction process without assigning any reason and without any liability.

any kind of binding obligation on the part of the Liquidator or the Company to effectuate the

2.E-Auction will be conducted on "AS IS WHERE IS", "AS IS WHAT IS", "WHATEVER THERE IS" and "NO RECOURSE BASIS" through approved service provider, M/s. e Procurement Technologies Limited (Auction Tiger) https://nctt.auctiontiger.net.

3.The last date for submission of Eligibility documents and Refundable Deposit as

mentioned in the Process Documents is 27" February, 2024. Inspection Date-1" March, 2024 to 7" March, 2024. The Bid Documents details and EMD payment details should reach the office of the Liquidator physically or by E-mail at the address given below by 06:00 PM on 9th March, 2024.

Any modification in timelines and/or in the "e-auction process information document including terms and conditions will be notified in the website of the Corporate Debtor i.e https://bilinfratech.com,

5.For any query, contact Mr. Subodh Kumar Agrawal, mob- 9830022848, mail id-cirp.bilinfra@gmail.com or Contact: Mr. Praveen Kumar Thevar 9722778828 - 079 6813 6854/55/51; Email ID: praveen.thevar@auctiontiger.net.

Subodh Kumar Agrawa Date: 12.02.2024 BIL Infratech Limited- In Liquidation

IBBI Regn No.: IBBI/IPA-001/IP-P00087/2017-18/10183 AFA Valid till 21/11/2024

1, Ganesh Chandra Avenue, 3rd. Floor, Room No-301, Kolkata-700013 cirp.bilinfra@gmail.com/subodhka@gmail.com

## JM FINANCIAL LIMITED

Corporate Identity Number: L67120MH1986PLC038784

Registered Office: 7th Floor, Cnergy, Appasaheb Marathe Marg, Prabhadevi, Mumbai 400025.

Tel. No.: +91 22 6630 3030 • Fax: +91 22 6630 3223 • Website: www.imfl.com

#### STATEMENT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED DECEMBER 31, 2023 Rupees in Cror Quarter Ended Nine Months Ended Year Ende **Particulars** 31.12.2023 30.09.2023 31.12.2022 31.12.2023 31.12.2022 31.03.2023 Unaudited Unaudited Unaudited Unaudited Income 674.76 632.06 532.21 1,889.06 1,509.95 275.78 496.47 296.22 199.61 774.96

- (a) Revenue from Operations 2,091.87 (i) Interest Income (ii) Fees and Commission Income 657.48 (iii) Brokerage Income 121.54 123.10 74.33 331.15 217.16 314.03 (iv) Net gain on fair value changes 131.43 147.87 116.50 459.54 340.39 183.42 (v) Net gain on derecognition of financial instruments carried 0.07 0.56 0.16 0.71 0.06 0.10 at amortised cost (vi) Other Operating Income 11.48 18.50 6.79 44.60 17.26 24.60 Total Revenue from Operations 1,235.99 1,197.38 929.60 3,500.02 2,581.29 3,271.50 (b) Other Income 24.97 16.58 16.53 56.02 47.59 71.57 **Total Income** 1,260.96 1,213.96 946.13 3.556.04 2,628.88 3,343.07 Expenses 400.29 388.10 1.154.27 1.178.51 Finance costs 301.45 831.98 Impairment on financial instruments 48.62 126.85 42.34 321.55 103.87 95.56 Employee benefits expense 246.00 235.99 159.33 675.41 447.97 622.34 Depreciation and amortization expense 13.68 13.16 10.46 38.87 30.09 41.87 Other Expenses 135.25 171.93 110.91 440.45 316.34 452.18 (e) 843.84 936.03 624.49 2,630.55 1,730.25 2.390.46 Total expenses Profit before tax (1-2) 417.12 277.93 321.64 925.49 898.63 952.61 Tax expenses (a) Current tax 76.45 93.38 85.78 253.45 180.30 243.5 Deferred tax 19.23 (20.34)(3.48)(29.18)42.16 0.61 Tax adjustment of earlier years (net) (0.12)(0.65)(0.93)(1.18)(0.04)(0.30)95.56 Total tax expenses 72.39 81.37 223.09 222.42 243.85 Net Profit for the period / year (3-4) 321.56 205.54 240.27 702.40 676.21 708.76 Add :- Share in profit of associate 0.79 0.40 2.45 0.42 0.2 676.63 322.35 205.94 240.27 704.85 708.99 Net Profit after tax and share in profit of associate (5+6) Other Comprehensive Income (OCI) (i) Items that will be reclassified to profit or loss -Exchange differences on translation of foreign operations 0.28 2.65 3.11 2.37 12.16 10.99 (ii) Items that will not be reclassified to profit or loss (0.63)(1.22)(0.37)(1.09) Remeasurement of defined benefit obligations (2.04)(0.55)- Share in Other Comprehensive Income of Associate -Income tax on the above 0.17 0.29 0.10 0.51 0.28 0.14Total Other Comprehensive Income (0.18)1.72 2.84 0.84 11.35 10.58 Total Comprehensive Income for the period / year (7+8) 207.66 243.11 705.69 687.98 719.57 Net Profit attributable to (7): Owners of the company 277.68 194.94 190.16 638.52 540.18 597.29 Non-controlling interests 11.00 66.33 136.45 111.70 44.67 50.11 11 Other Comprehensive Income attributable to (8): Owners of the company (0.14)1.87 2.87 1.04 11.43 10.62 Non-controlling interests (0.15)(0.08)(0.04)(0.04)(0.03)(0.20)12 | Total Comprehensive Income attributable to (9): Owners of the company 277.54 196.81 193.03 639.56 551.61 607.91 136.37 Non-controlling interests 44.63 10.85 50.08 66.13 111.66 13 Paid up equity share capital (Face value Re. 1/- per share) 95.55 95.51 95.48 95.55 95.48 95.48
  - Diluted EPS (in Rs.) Not annualised for the quarters and nine months period

Other equity (excluding revaluation reserves)

15 Earning Per Equity Share (EPS)\* Basic EPS (in Rs.)

#### # Denotes amount below ₹ 50,000/-Notes

1. The unaudited standalone and consolidated financial results for the third quarter and nine months ended December 31, 2023 have been reviewed by the Audit Committee, and on its recommendation, have been approved by the Board of Directors at its meeting held on February 12, 2024 in accordance with Regulation 33 of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended (the "Listing Regulations"). The said results have been subjected to limited review by the Statutory Auditors of the Company, who have issued an

2.91

2.91

2.04

2.04

1.99

1.99

6.69

6.68

- 2. The said standalone and consolidated financial results have been prepared in accordance with the recognition and measurement principles laid down in the Indian Accounting Standard 34 "Interim Financial Reporting" (Ind AS 34) prescribed under Section 133 of the Companies Act, 2013 and other accounting principles generally accepted in India and in compliance with Regulation 33 of the Listing Regulations.
- 3. During the guarter ended December 31, 2023, the Allotment Committee of the Board has allotted an aggregate of 4,24,930 equity shares of the face value of Re. 1/- each to the eligible employees upon exercise of stock options by them. Consequent upon the said allotment of shares, the total paid up equity share capital of the Company has increased to Rs. 95,55,28,952/- (Rupees Ninety five crore fifty five lakh twenty eight thousand nine hundred and fifty two only) representing 95,55,28,952 equity shares of the face value of Re. 1/- each.
- The gross charge for share based payments towards stock options granted by the Company is Rs. 0.36 Crore and Rs. 0.86 Crore for the third quarter and nine months ended December 31, 2023 respectively.
- 4. During the nine months ended December 31, 2023, the Company received the NCLT order approving the Scheme of Arrangement (the "Scheme") on April 20, 2023 with the appointed date being April 1, 2023 which was filed with National Company Law Tribunal (the "NCLT") during the financial year 2022-23. The Scheme involved demerger of the undertaking comprising Private Wealth and Portfolio Management Services (the "PMS") and the investment in JM Financial Institutional Securities Limited (which houses the institutional equities business) from its wholly owned subsidiary, JM Financial Services Limited (the "JMFSL") to the Company. The Scheme also comprised merger of JM Financial Capital Limited (the "JMFCL"), which is a wholly owned subsidiary of JMFSL, into JMFSL. Upon the Scheme becoming effective from May 18, 2023 (on filing of required forms with the Registrar of Companies, Mumbai) -
- > JMFCL has ceased to be a step-down subsidiary of the Company consequent upon its merger with JMFSL;

The impact of the Scheme on the standalone financial results are as follows:

- > JM Financial Institutional Securities Limited has become a direct wholly owned subsidiary of the Company; and
- > The Private Wealth and PMS divisions have been demerged from JMFSL and have become part of the Company and are classified under the Investment Bank segment from the Platform AWS segment.

Consequent to the above, the standalone financial results and consolidated segment-wise details for the quarter and nine months ended December 31, 2022 and for the year ended March 31, 2023 have been restated from the published results to give the impact of the Scheme.

Particulars Quarter Ended Nine Months Ended Year Ended 31.12.2022 31.12.2022 31.03.2023 Restated Reported Restated Reported Restated Reported 181.40 Total Income 199.17 420.63 469.86 488.56 555.46 Total Expenses 47 25 66.27 134 69 192.05 175 27 258.79 134.15 285.94 Profit before tax 132.90 277.81 313.29 296.67 Profit after tax 121.93 120.68 252.99 244.86 273.07 256.45 Total Comprehensive Income 121.84 120.59 252.71 244.58 272.94 256.32

# JM FINANCIAL

	SEGMENTWISE THE QUARTER AND					8	
	THE QUARTER AND	MINE MON	IIIO LNDL	DECEMB			Rupees in Crore
1			Quarter Ended			Nine Months Ended	
	Particulars	31.12.2023 Unaudited	30.09.2023 Unaudited	31.12.2022 Unaudited (Restated)**	31.12.2023 Unaudited	31.12.2022 Unaudited (Restated)**	31.03.2023 Audited (Restated)**
	Segment Revenue						
Α	Investment Bank	487.33	495.00	368.17	1,373.25	1,007.03	1,299.11
В	Mortgage Lending	392.54	367.44	334.86	1,125.39	941.67	1,318.49
С	Alternative & Distressed Credit	110.57	113.59	90.58	364.32	257.11	137.13
D	Asset Management, Wealth Management & Securities Business (Platform AWS)	264.65	237.84	145.57	677.88	406.82	560.88
Е	Others	54.14	53.39	51.42	154.27	137.23	180.30
	Total Segment Revenue	1,309.23	1,267.26	990.60	3,695.11	2,749.86	3,495.91
	Less: Inter – segmental revenue	(48.27)	(53.30)	(44.47)	(139.07)	(120.98)	(152.84)
	Total Revenue	1,260.96	1,213.96	946.13	3,556.04	2,628.88	3,343.07
	Segment Results (Profit / (loss) before tax)						
Α	Investment Bank	196.58	184.07	132.90	515.99	381.86	486.47
В	Mortgage Lending	126.53	27.90	119.51	174.22	317.45	467.72
С	Alternative & Distressed Credit	20.38	17.92	15.92	68.22	47.62	(172.02)
D	Asset Management, Wealth Management & Securities Business (Platform AWS)	36.18	10.74	12.79	59.21	36.13	22.89
Е	Others	37.45	37.30	40.52	107.85	115.57	147.55
	Total Results	417.12	277.93	321.64	925.49	898.63	952.61
	Segment Assets*						
Α	Investment Bank	7,951.43	7,708.22	7,299.05	7,951.43	7,299.05	7,095.84
В	Mortgage Lending	11,880.04	11,707.17	10,908.11	11,880.04	10,908.11	11,735.15
С	Alternative & Distressed Credit	4,738.18	5,262.29	4,966.08	4,738.18	4,966.08	4,817.10
D	Asset Management, Wealth Management & Securities Business (Platform AWS)	5,029.44	4,485.75	2,965.15	5,029.44	2,965.15	3,667.82
Е	Others	2,244.34	2,255.47	1,870.24	2,244.34	1,870.24	2,002.09
	Total Segment Assets	31,843.43	31,418.90	28,008.63	31,843.43	28,008.63	29,318.00
	Segment Liabilities						
Α	Investment Bank	5,010.37	4,859.51	4,617.31	5,010.37	4,617.31	4,366.18
В	Mortgage Lending	7,334.17	7,325.99	6,666.69	7,334.17	6,666.69	7,386.49
С	Alternative & Distressed Credit	3,044.25	3,584.34	3,105.85	3,044.25	3,105.85	3,004.67
D	Asset Management, Wealth Management & Securities Business (Platform AWS)	4,282.95	3,804.44	2,285.27	4,282.95	2,285.27	2,982.34
E	Others	498.66	496.84	267.96	498.66	267.96	360.91
	Total Segment Liabilities	20,170.40	20,071.12	16,943.08	20,170.40	16,943.08	18,100.59
	Segment Capital Employed*						
Α	Investment Bank	2,941.06	2,848.71	2,681.74	2,941.06	2,681.74	2,729.66
В	Mortgage Lending	4,545.87	4,381.18	4,241.42	4,545.87	4,241.42	4,348.66
С	Alternative & Distressed Credit	1,693.93	1,677.95	1,860.23	1,693.93	1,860.23	1,812.43
D	Asset Management, Wealth Management & Securities Business (Platform AWS)	746.49	681.31	679.88	746.49	679.88	685.48
Е	Others	1,745.68	1,758.63	1,602.28	1,745.68	1,602.28	-
	Total Capital Employed	11,673.03	11,347.78	11,065.55	11,673.03	11,065.55	11,217.41

\* Segment Assets and Capital Employed presented are net of Goodwill on consolidation amounting to Rs. 52.44 Crore.

standalone basis.

7,988.34

Rupees in Crore

6.26

6.25

5.66

5.66

On a consolidated basis, the Group has four reportable segments. namely.

- (i) Investment Bank which caters to Institutional, Corporate, Government and Ultra High Net-worth clients and includes investment banking, institutional equities & research, management of private equity funds, fixed income, private wealth management, portfolio management services, syndication and finance;
- (ii) Mortgage Lending which includes both wholesale mortgage lending (primarily catering to real estate developers) and retail mortgage lending (affordable home loans and secured MSME):
- (iii) Alternative & Distressed Credit which includes the asset reconstruction business; and
- (iv) Asset Management, Wealth Management & Securities Business (Platform "AWS") which provides an integrated investment platform to individual clients and includes elite and retail wealth management business, broking and mutual fund business.
- The revenue from others include property rental income, income from the proceeds of Qualified Institutions Placement issue, pending its final deployment, and

The reportable segments are in line with the segment wise information as presented to the Chief Operating Decision Maker (the "CODM"). The Company and the

Group do not have any material operations outside India and hence disclosure of geographic segments is not required. As per Ind AS 108 'Operating Segments', segment-wise details are disclosed on a consolidated basis and hence, no separate disclosure has been given on a

5. The aforesaid consolidated and standalone financial results for the third quarter and nine months ended December 31, 2023 are being uploaded on the Company's website viz., www.jmfl.com and the websites of BSE Limited and National Stock Exchange of India Limited viz., www.bseindia.com and www.nseindia.com respectively.

Key stand-alone financial information is given below:

Particulars	Quarter Ended			Nine Mont	Year Ended	
	31.12.2023 Unaudited	30.09.2023 Unaudited	31.12.2022 Unaudited (Restated)**	31.12.2023 Unaudited	31.12.2022 Unaudited (Restated)**	31.03.2023 Audited (Restated)**
Total Income	223.07	265.48	199.17	630.36	469.86	555.46
Profit before tax	118.13	161.79	132.90	342.81	277.81	296.67
Profit after tax	89.82	142.47	120.68	282.13	244.86	256.45
Total Comprehensive Income	89.55	141.97	120.59	281.32	244.58	256.32

\*\* Refer Note 4 above

For and on behalf of the Board of Directors

Adi Patel

Place: Mumbai Date: February 12, 2024 Joint Managing Director (DIN: 02307863)





# આઈ.ઓ.બી.ની આશ્રમ રોડ શાખાના રિનોવેશનપ્રસંગે રૂા. ૨૦૩ કરોડની લોન મંજૂર

ઈન્ડિયન ઓવરસીઝ બેંકના ૮૮મા સ્થાપના દિવસની ઉજવણીના અવસર પર આઈ.ઓ.બી. આશ્રમ રોડ શાખા અને એસેટ રિકવરી મેનેજમેન્ટ શાખા, અમદાવાદ ખાતે ગ્રાહકો માટે ગ્રાહક મૈત્રીપૂર્ણ સુવિધાઓ અને ઉચ્ચ કક્ષાના વાતાવરણ સાથે રિનોવેટેડ બેંક શાખા પરિસરનું ઉદ્દ્રઘાટન બેંકના ચીફ રિજનલ મેનેજર શંકરનાદ ઝા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રી શંકરનાદ ઝાએ કૃષિ અને MSME અને હાઉસિંગ લોન માટે રૂ.૨૦૩ કરોડના લોન મંજૂર પત્રોનું વિતરણ કર્યું હતું. બેંકે ૧૦ વર્ષથી વધુ સમયથી બેંક સાથે સંકળાયેલા મૂલ્યવાન ગ્રાહકોનું પણ સન્માન કર્યું હતુ અને બેંકના તમામ ગ્રાહકોને તેમના સમર્થન બદલ આભાર માન્યો હતો. તેમણે ગ્રાહકોને ડિજીટલ બેન્કિંગ, સેવિંગ્સ બેંકમાં નવી પ્રોડક્ટ્સ, કરન્ટ એકાઉન્ટ અને રિટેલ અને એમએસએમઈ પ્રોડક્ટ્સ સહિત બેક્રિંગના વિવિધ ક્ષેત્રોમાં બેક્ર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલી ટોચની કક્ષાની સુવિધાઓનો ઉપયોગ કરવા જણાવેલ હતું.

### ચાઈનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપનીઓએ માહિતી આપી

## ચીનની કંપનીઓ ભારતમાં પ્લાન્ટ નાખતા ગભરાય છે

જાણકારી મુજબ તેના ભારતમાં જ તેના સ્માર્ટફોન કમ્પોનન્ટની આયાત પર ટેરિફ સપ્લાયર્સને ભારતમાં કામગીરી શરુ કરવામાં મુશ્કેલીઓ પડે છે. તેમજ ભારતમાં ચીની કંપનીઓની તપાસ કરવામાં આવતી હોવાથી આ ચાઈનીઝ કંપનીઓ ભારતમાં પ્લાન્ટ

સ્થાપવાથી ડરે છે. એક અખબારના રિપોર્ટ અચકાય છે.

ઝિયોમીભારતની સૌથી મોટી હતો. જેના જવાબમાં કંપનીએ

બેઈજિંગ, તા.૧૨ સ્માર્ટફોન કંપની છે. જે ભારતમાં ચાઈનીઝરમાર્ટફોન નિર્માતા ભારતની માર્કેટમાં ૧૮ ટકા પ્રોત્સાહન આપવા તેમજ કંપનીઓ પાસેથી મળતી હિસ્સો ધરાવે છે. કંપની અમુકપસંદકરેલસ્માર્ટફોનના

ભારતમાં ચીની કંપનીઓની તપાસ થતી હોવાથી આ ચાઈનીઝ કંપનીઓ ભારતમાં પ્લાન્ટ સ્થાપવાથી ડરે છે

અનુસાર ચીની કંપની દ્વારા એસેમ્બલ કરે છે, જેમાં અમુક ભારતને એક પત્ર લખવામાં સ્પેરપાર્ટ્સ ચીનથી આયાત કરે આવ્યો હતો જેમાં કંપનીએ છે તો એમુક ભારતમાં બનેલા જશાવ્યું હતું કે ભારતમાં સરકાર કમ્પોનન્ટનો ઉપયોગ કરે છે. દ્વારા ચાઈનીઝ કંપનીઓની આથી ભારત સરકારે આ તપાસ થતી હોવાના કારણે ચાઈનીઝ કંપનીને દેશમાં સ્માર્ટફોન કમ્પોનન્ટ સપ્લાયર્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ ભારતમાં કામગીરી શરુ કરતા સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે શું પગલાં લેવા જો ઈએ એ બાબતે માર્કેટ શેરની દ્રષ્ટિએ ૬ ફેબ્રુઆરીના રોજપત્ર લખ્યો

PF પર વ્યાજ વધ્યું, તેથી DA ની અપેક્ષા વધી

## કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકાર આપી શકે છે મોટી ભેટ

આપતા કર્મચારી ભવિષ્ય નિધિ કરતા ૦.૧૦ ટકા વધુ વ્યાજ સંગઠન એ શનિવારે વ્યાજદરમાં મળશે. ગયા વર્ષે ૨૮ માર્ચે, વધારાની જાહેરાત કરી હતી. જે EPFOએ ૨૦૨૨-૨૩ માટે હવે વધારીને ૮.૨૫ ટકા કરી કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) દેવામાં આવી છે. ચૂંટણીના વર્ષમાં ખાતાઓ માટે ૮.૧૫ ટકાના

પીએફ પર **મોદી સરકાર વર્ષ ૨૦૨૪ના** જાહેરાત કરી થયા બાદ હવે **પહેલા છ મહિનામાં કેન્દ્રીય** હતી. પીએફના

આશા છે. જો અહેવાલો પર અને તેને વધારીને ૮.૨૫ ટકા શકે છે.

નવી દિલ્હી, તા.૧૨ કરી છે. પીટીઆઈ અનુસાર, PF ખાતાધારકોને મોટી ભેટ પીએફ ખાતાધારકોને હવે પહેલાં

મોંઘવારી ભથ્થા માં ટૂંક સમયમાં **કર્મચારીઓને ડીએમાં** વધારા સાથે વધારો થવાની **વધારાની ભેટ આપી શકે છે** કે ન દ્રી ય

કર્મચારીઓમાં વિશ્વાસ કરવામાં આવે તો સરકાર પણ ડીએમાં વધારાની આશા વધી માર્ચ ૨૦૨૪માં આ અંગે મોટો ગઈ છે. સરકાર કર્મચારીઓના નિર્ણય લઈ શકે છે. જો આવું થાય મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વાર છે. તો કેન્દ્રીય કર્મચારીઓને વધારો કરે છે અને જાન્યુઆરી-આપવામાં આવતો ઢછ ૫૦ ટકા જૂન અર્ધ વર્ષ માટે ઢછ<sup>ે</sup> વધારો થઈ જશે. EPFO ના સેન્ટ્રલ બોર્ડ માર્ચ ૨૦૨૪ માં જાહેર કરવામાં ઓફ ટ્રસ્ટી એ નાણાકીય વર્ષ આવે તેવી અપેક્ષા છે. જો ૨૦૨૩-૨૪ માટે કર્મચારી અહેવાલોનું માનીએ તો આ વખતે ભવિષ્ય નિધિ ખાતા માટે નવા સરકાર ચૂંટણી પહેલા કેન્દ્રીય વ્યાજ દરની જાહેરાત કરી છે. કર્મચારીઓને ૪ ટકા ડીએ EPFO એ દેશના લગભગ ૭ વધારાની ભેટ આપી શકે છે અને કરોડ કર્મચારીઓને ભેટ આપી છે તેની જાહેરાત આવતા મહિને થઈ

### મોંઘવારી-રોજગારીના સંકટમાં છટણીનો દોર

## સ્પાઈસ જેટમાં નાણાંકીય સંકટ, હજારો કર્મચારીઓ ઉપર છટણીની તલવાર

નવી દિલ્હી, તા.૧૨ હજારની આસપાસ છે.

મોંઘવારી અને રોજગારીના સંકટ વચ્ચે દુનિયાભરમાં વિમાનનો કાફલો છે જેમાં ૮ છટણીનો દોર પણ ચાલુ છે ત્યારે લીઝ પર લીધેલા છે. અહેવાલ ભારતમાં પણ હવે છટણીનો અનુસાર એરલાઇન્સ દ્વારા માહોલ ચાલુ થયો છે. તાજેતરમાં છટણીના આ અહેવાલોની પુષ્ટી

ભારતની બજેટ એરલાઈન સ્પાઈસજેટે હજારો કર્મચારીઓની નોકરીઓ પર કાતર ફેરવવાનો નિર્ણય કર્યો છે. કંપની નાણાકીય

સંકટનો સામનો કરી રહી છે.

કટિંગના ભાગરૂપે છટણી વધીરહ્યું છે. કરવાનો નિર્ણય લીધો છે. કુલ કર્મચારીઓની સંખ્યા ૯ છે.

કંપની પાસે હાલમાં ૩૦



પણ કરાઈ હતી. કંપની પર જેટના રોકાણકારોનો વિશ્વાસ જાળવી જણાવ્યાનુસાર કંપનીએ કોસ્ટ રાખવા માટે ખર્ચ ઘટાડવા દબાણ

કંપનીના અહેવાલ અનુસાર સ્પાઈસજેટ કર્મચારીઓનું સેલરી બિલ ૬૦ ૧૪૦૦ કર્મચારીઓની છૂટાં કરોડ રૂ. થઈ ગયું છે. એવામાં કરવાની તૈયારીમાં છે જે ટોટલ કંપની ખર્ચ ઘટાડવા દરેક સંભવ વર્કફોર્સના આશરે ૧૫ ટકા પ્રયાસ કરવા મજબૂર છે. આ જેટલાં થાય છે. હાલ કંપનીના છટણી પણ તેનો જ એક ભાગ

### Saanvi

CIN: L74140GJ1981PLC084205

Regd. Office: 304, Shopper's Plaza - V, Government Servants Co-op. Housing Society Limited, Opp. Municipal Market, C.G. Road, Navrangpura, Ahmedabad - 380009 Phone No.: Ph. No.: 079-48904153 Email: saptharishifin@gmail.com Website: www.saanviadvisors.in

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED ON 31ST DECEMBER, 2023 (Rs. ln Lakhs) Quarter Nine Corresponding Year

T dividuals	ended on 31-12-2023	Months ended on 31-12-2023	3 months ended in the previous year 31-12-2022	ended on 31-03-2023
	(Unaudited	(Unaudited)	(Unaudited)	(Audited)
- Income from Operations		-	2.27	36.16
- Other Income	7.41	25.97	8.79	23.17
- Total Income	7.41	25.97	11.06	59.33
- Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items) - Net Profit / (Loss) for the period	6.52	20.62	2.14	25.63
before tax (after Exceptional and / or Extraordinary items) - Net Profit / (loss) for the period after tax (after Exceptional and /	6.52	20.62	2.14	25.63
or Extraordinary items)  - Total Comprehensive Income for the period (Comprising Profit / (loss) for	4.88	15.43	1.61	16.72
the period (after tax) and other comprehensive Income (after tax)	4.88	15.43	1.61	16.72
- Paid-up equity Share Capital	201.05	201.05	201.05	201.05
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year - Earnings per Share (of Rs.10/-each)	-	-	201.00	81.17
(for continuing operations)				
-Basic	0.24	0.77	0.08	0.83
-Diluted	0.24	0.77	0.08	0.83

1) The above is an extract of the detailed format of the quarter and nine months ended Unaudited Financial Results filed with the stock exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements Regulations, 2015. The Full format of the unaudited Financial Results is available on the stock Exchange website - www.msei.in & company's website - www.saanviadvisors.in

 The above financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors in the meeting held on 12th February, 2024 The company has adopted Indian Accounting Standard ("IND AS" notified by the Ministry of Corporate Affairs with effect from 1st Apri 2017. Accordingly, the Financial Result for the quarter and nine months ended on 31st December, 2023 in accordance with IND-AS and other g principles generally accepted in India.

Date: 12/02/2024 Roopesh Ved, Director - DIN: 01504998

# METROGLOBAL

ઘટાડવા કહ્યું હતું. વર્ષ

૨૦૨૦ના ભારત અને ચીન

વચ્ચે હિંસક સીમા વિવાદ બાદ

ભારત સરકાર દ્વારા ચીની

કંપનીઓ સામે કડક કાર્યવાહી

કરવામાં આવી છે. જેમાં સેંકડો

ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધનો

પણ સમાવેશ થાય છે. તેમજ

આ કંપનીઓ પર પૈસાની

ગેરરીતિનો આરોપ પણ છે.

### મેટ્રોગ્લોબલ લિમિટેડ

રજી. ઓફિસઃ ૫૦૬-૫૦૯, શીલ્પ, ગીરીશ કોલ્ડ ડ્રીંક્સ સામે, સી.જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ - ૩૮૦૦૦૯, ગુજરાત. CIN: L21010GJ1992PLC143784 વેબસાઈટ: www.metrogloballimited.com ઈ-મેઈલ: cs@metroglobal.in

પોસ્ટલ બેલેટ અને ઈ-વોટિંગની માહિતી આપતી નોટીસ

આથી કંપનીના સભ્યોને જણાવવામાં આવે છે કે કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) રૂલ્સ, ૨૦૧૪ (ધ મેનેજમેન્ટ રૂલ્સ)ના નિયમો ૨૨ અને ૨૦ને વંચાણ લેવાની સાથે કંપનીઝ એક્ટ, ૨૦૧૩ (ધ એક્ટ – કાયદા)ની ક્લમ ૧૦૮ અને ૧૧૦ની જોગવાઇઓ અને અન્ય લાગુ પડતી જોગવાઇઓ અન્વયે, કોર્પોરેટ બાબતોના મંત્રાલય, ભારત સરકાર (ધ એમસીએ સરક્યુલર્સ – કોર્પોરેટ મંત્રાલયના પરિપત્રો) દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્ર નં ૧૪/૨૦૨૦ તારીખ ૮ એપ્રિલ ૨૦૨૦, ૧૭/૨૦૨૦ તા. ૧૩ એપ્રિલ ૨૦૨૦, ૨૦/૨૦૨૦ તા. ૫ મે ૨૦૨૦, ૨૨/૨૦૨૦ તા. ૧૫ જૂન ૨૦૨૦, ૩૩/૨૦૨૦ તા. ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૦, ૩૯/૨૦૨૦ તા. ૩૧ ડીસેમ્બર ૨૦૨૦, ૧૦/૨૦૨૧ તા. ૨૩ જૂન ૨૦૨૧, ૨૦/૨૦૨૧ તા. ૮ ડિસેમ્બર ૨૦૨૧, ૩/૨૦૨૨ તા. ૫ મે ૨૦૨૨, ૧૧/૨૦૨૨ તા. ૨૮ ડીસેમ્બર ૨૦૨૨ અને ૦૯/૨૦૨૩ તા. ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૩ના સામાન્થ પરિપત્રો સમાન્ય સભા (ધ એસએસ–૨) પરના સેકેટરિયલ સ્ટાન્ડર્ડ (ધોરણો)-૨, હાલ પૂરતા અમલી કોઈપણ વૈદ્યાનિક સુધારા, ખુલાસા અવેજી વિકલ્પ, પુર્નઅધિનિયમ સહિત કોર્પોરેટ બાબાતોના મત્રાલય (ધ એમસીએ) દ્વારા નિયત સિક્યોરિટિઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (લિસ્ટિંગ ઓબ્લીગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટસ)ના રેગ્યુલેશન-૪૪ અને અન્ય કોઇપણ લાગુ પડતા કાયદા અને નિયમો અન્વયે મેટ્રો ગ્લોબલ લિમિટેડ (ધ કંપની)ના સભ્યો પાસેથી રિમોટ ઇ-વોટિંગ દ્વારા નીચે દર્શાવેલા ખાસ 6રાવ (સ્પેશિયલ રીઝોલ્યુશન) માટે મંજૂરી માંગવામાં આવે છે.

### ખાસ ઠરાવનું વિવરણ

શ્રી પ્રશાંત ખેસકાની (ડીન: ૦૨૫૮૯૬૫૪) કંપનીના નોન-એક્ઝિક્યુટીવ ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે પાંચ વર્ષની બીજી મુદત માટે પુન:નિમણક. દ્ય કોર્પોરેટ બાબતોના મંત્રાલયના (દ્ય એમસીએ) પરિપત્રો અન્વયે કંપનીએ શુક્રવાર, ૦૯ ફેબ્રુઆરી, ૨૦૨૪ના (કટ

ઓફ તારીખ) રોજ કંપની/ડિપોઝિટરી પાર્ટિસિપન્ટસ સાથે નોંધાયેલા સભ્યો ઈલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા ખુલાસાકારક निવेદન સાથે પોસ્ટલ બેલેટ્સની ઇલેક્ટ્રોનિક નક્લોની રવાનગી (ડિસ્પેચ) કરવાની કામગીરી ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ પૂર્ણ કરેલ છે.

ધ એમસીએ પરિંપત્રોની જોગવાઈઓ અનુસાર, સભ્યો માત્ર ઇ–વોટિંગ પ્રક્રિયા દ્વારા જ વોટ (મત) આપી શકે છે. સભ્યોને મતાધિકાર કટ ઓફ તારીખે તેમના દ્વારા ધારણ કરવામાં આવતા કંપનીના ઇક્વિટી શેરોના આધારે ગણતરીમાં લઈને અન્થ રાખવામાં આવશે. કટ ઓફ્ તારીખના રોજ જે વ્યક્તિ કંપનીની શેર ધારક ન હોય તેઓ પોસ્ટલ બેલેટની નોટીસને માત્ર માહિતી તરીકેના હેતુ તરીકે લેવાશે.

કંપનીએ તેના તમામ સભ્યોને ઇ-વોટિંગની સુવિધા પૂરી પાડવાના હેતુસર સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસિઝ (ઇન્ડિયા) લિમિટેડની (સીડીએસએલ) સેવાઓ પ્રાપ્ત કરી છે. ઈ–વોટિંગની સુવિધા નીચે દર્શાવેલા સમય દરમ્યાન ઉપલબ્ધ

ı	બનશ.	
	ઈ-વોટિંગ સમચાવધિનો પ્રારંભ	બુધવાર, ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ ભારતીય સ્ટાન્ડર્ડ સમય (આઈએસડી) પ્રમાણે સવારે ૯–૦૦ વાગ્યાથી
l	ઈ-વોટિંગ સમયાવધિની સમાપ્તિ	ગુરૂવાર, ૧૪ માર્ચ ૨૦૨૪ના રોજ ભારતીય સ્ટાન્ટર્ડ (આઈએસડી) પ્રમાણે સાંજે ૫–૦૦ વાગ્યે
l	મત આપવાની પાત્રતા માટેની કટઓક તારીખ	શકવાર. ૦૯ કેબ્રઆરી, ૨૦૨૪

ગુરૂવાર, ૧૪ માર્ચ ૨૦૨૪ના રોજ સાંજે ૫-૦૦ વાગ્યા બાદ તુરંત સીડીએસએલ દ્વારા ઈ-વોટિંગની સુવિધા બંધ કરી દેવામાં આવશે. જે સભ્યોને પોતાના ઇ–મેલ એડ્રેસ (સરનામાં) અપડેટ કરાવ્યા નથી તેઓને પોતાના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટસ મારફતે ડિપોઝિટરી સાથે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં ધરાવતા શેરોના સંદર્ભમાં રજીસ્ટર કરવા વિનંતી છે અને જો તેઓ ફિઝિક્લ સ્વરૂપમાં શેર ધરાવતા હોય તે આવા શેરોના સંદર્ભમાં કંપનીના રિજસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ એટલે કે લિંક ઇનટાઇમ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડને mt.helpdesk@linkintime.co.in પર ઇ-મેલ કરીને લેખિતમાં રજીસ્ટર કરાવવા વિનંતી કરવામાં આવે છે.

કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા યોગ્ય અને પારદર્શક રીતે પોસ્ટલ બેલેટ પ્રક્રિયાનું સંચાલન કરવા માટે શ્રી જિંગ્નેશ શાહ, વકીલની (નોંધણી નં. જી/૪૯૦૮/૨૦૨૨) તપાસકર્તા (સ્કૂટિનાઈઝ૨) તરીકે નિમણૂક કરી છે. સીડીએસએલ ઈ-વોટિંગ સિસ્ટમ તરફથી ઈ-વોટિંગ અંગે કોઈપણ પૂછ-પરછ કરવી હોય કે કોઈ પણ મુદ્દો હોય તો તમે <u>helpdesk.evoting@cdslindia.com</u> પર ઇ–મેલ કરી શકો છો અથવા ટોલ ફ્રી નં. ૧૮૦૦–૨૨–૫૫–૩૩ ઉપર સંપર્ક કરી શકો છે. મેટોગ્લોબલ લિમિટેક વતી

તારીખ: ૧૩, ફેબ્રુઆરી, ૨૦૨૪

સહી/-राह्स कै (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીએફઓ, ડીન: ૦૧૮૧૩૭૮૧)



### FRESHTROP FRUITS LIMITED

CIN: L15400GJ1992PLC018365

Reg. Office: A 603, Shapath IV, S. G. Road, Ahmedabad - 380015 Tel: 079 40307050-57, E-mail: info@freshtrop.com, Website: www.freshtrop.com

			(Rs. in Lakhs)
	Quarter Ended	Nine Months Ended	Quarter Ended
Particulars	31.12.2023	31.12.2023	31.12.2022
	(Audited)	(Audited)	(Unaudited)
Total income from operations (net)	2458.89	6,986.94	3,248.71
Net Profit for the period (before tax and exceptional items)	-449.03	-616.22	377.63
Net Profit for the period before tax (after exceptional items)	-449.03	-616.22	377.63
Net Profit for the period after tax (after exceptional items)	4725.34	6,015.63	207.95
Total Comprehensive Income for the period	-8.16	-6.64	13.94
Profit/ Loss for the period after comprehensive income	4717.18	6,008.99	221.89
Equity Share Capital	989.49	989.49	1,068.80
Earning Per Share (Of Rs. 10 each) (after extraordinary items)	\$2363604040	Recentrates	
Basic:	47.76	60.80	1.95
Diluted:	47.76	60.80	1.95

Extract of Audited Financial Results for the Quarter and Nine Months Ended on 31st December, 2023

(1) The above is an extract of the detailed format of Financial Results for the guarter and nine months ended on 31.12.2023, filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the website of the Stock Exchange i.e. www.bseindia.com and also on the ompany's website www.freshtrop.com.The result have been prepared in accordance with the Indian Accounting Standards ("Ind AS") as prescribed under section 133 of the Companies Act, 2013 read with relevant rules issued thereunder

(2) The above results were reviewed by the audit Committee and were approved and taken on record by the Board of Directors in their meeting held on February 12, 2024.
(3) Revenue From Operations includes Export Incentives

Place : Ahmedabad

Date: 12.02.2024

(4) Due to disposal of Fresh Fruit unit, the Company has only one segment of activity and hence segment reporting is not applicable to

(5) Due to disposal of Fresh Fruit unit, the financial results to the extent of Statement of Profit & Loss and its resulted impact on earning per share and segment for the quarters ended September 30, 2023 and December 31, 2022, for the nine month ended December 31, 2022, for the nine 31, 2022 and year ended March 31, 2023, have been restated by excluding figures of fresh fruit unit which have been included under discontinued operations for comparison purposes

(6) Previous Year's figures have been regrouped, reclassified wherever considered necess

For, Freshtrop Fruits Limited

Ashok Motiani **Managing Director** 

આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ

કોર્પોરેટ ઓફિસઃ યુનિટ નં. ૮૦૨, નટરાજ રૂસ્તમજી, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને એમ. વી. રોડ,

મહેસાણા શાખાઃઓફિસ નં.૩૦૫, ૩જે માળે, રાજકમલ સિટી મૉલ, રાજકમલ પેટ્રોલપંપ પાસે, સ્ટેટ હાઇવે, મહેસાણા-૩૮૪૦૦૨(ગુજ.) અમદાવાદ શાખાઃ ૩૦૧, ૩જે માળે, એબીસી-૩, હોટલ રિજેન્ટા સામે, ગિરીશ કોલ્ડ ડ્રિક્સ પાસે, ઉમાશંકર જોશી માર્ગ, ઓફ સી.જી. રોડ નવરંગપરા, અમદાવાદ-૩૮૦૦૦૯ (ગજરાત)

### એપેન્ડિક્સ-IV કબજા નોટિસ (સ્થાવર સંપત્તિ માટે)

નીચે સહી કરનાર આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિ.(એએચએફએલ)ના અધિકૃત અધિકારી છે અને ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇક્ષટરેસ્ટ એક્ટ ૨૦૦૨ના સેક્શન ૧૩(૧૨)ને સિક્યોરિટી ઇક્ષટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો ,૨૦૦૨ના નિયમ ૩ સાથે વંચાશે લેતા હેઠળ મળેલ અધિકારોની રૂએ કંપનીના અધિકૃત અધિકારી તરીકે નીચે જ્ણાવેલ દેશદાર(રો)/જામીનદાર(રો)ને ડિમાન્ડનોટિસ(સો) ઇસ્પૂ કરીને સંબંધિત ડિમાન્ડ નોટિસ(સો)માં ઉલ્લેખ થયેલ રકેમો આ નોટિસ મળ્યાની તારીખથી દિન ૬૦માં ભરપાઈ કરી જવા કહેલ. દેણદાર આ રકમ ચૂકવવામાં નિષ્ફળ જવાને લીધે, અત્રે દેણદાર(રો)/જામીનદાર(રો)ને તથા જાહેર જનતાને નોટિસ આપવામાં આવે છે કે નીચે સહી કરનારે સદરહુ કાયદાના સેક્શન ૧૩ના સબ-સેક્શન (૪) અને સિક્યોરિટી ઇ#ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમો પૈકી નિયમ ૮ સાથે વંચાણે લેતાં હેઠળ નીચે વર્શન કરેલ મિલકતનો કબજો લીધો છે. સિક્યોર્ડ અસ્ક્યામત છોડાવવાન સંદર્ભે મળવાપાત્ર સમયમર્યાદા અંગે કાયદાના સેક્શન ૧૩ના સબસેક્શન (૮)ની જોગવાઈ તરફ દેણદારનું ધ્યાન દોરવામાં આવે છે દેણદાર વિશેષરૂપે અને જાહેર જનતાને સામાન્ય રીતે આ મિલકત સાથે કોઈ વ્યવહાર ન કરવા માટે ચેતવણી આપવામાં આવે છે અને કોઈ પણ આવે યવહાર અત્રે જણાવેલ રકમ તેના વ્યાજસહિતની રકમ સાથે એએચએફએલના ચાર્જને અધીન રહેશે

નં.	દેણદાર(રો)/સહ-દેણદારોનું નામ (મો)/(શાખાનું નામ)	સિક્યોર્ડ એસેટ (સ્થાવર મિલક્ત)નું વર્ણન	ડિમાન્ડ નોટિસની તારીખ અને રકમ	કંબજાતારીખ
9	(લોન કોડ નં. ૨૯૬૧૦૦૦૦૨૦૯/મહેસાણા શાખા) આનંદકુમાર (દેશદાર), તિમા હંસારામ (સહ-દેશદાર)	ભોંયતળિયે, આશાપુરા સોસાયટી, ડીસા રોડ, પ્લોટ નં.પદ પી દક્ષિણ બાજુ, (બ્લોક નં.૧૪) ડીસા, બનાસકાંઠા, ગુજરાત-૩૮૫૫૩૫ના તમામ હક્ક હિસ્સા. સીમાઓઃ પૂર્વેઃ પ્લોટ નં.૩૬ ની જમીન, પશ્ચિમેઃ રોડ, ઉત્તરેઃ પ્લોટ નં. પદ દક્ષિણેઃ પ્લોટ નં. ૫૫.	<u> </u>	02-03 <u>-</u> 303Y
2	(લોન કોડ નં. ૨૯૬૧૦૦૦૦૨૪૭/મહેસાણા શાખા) દશરથભાઈ કાંતિભાઈ જાગાણિયા (દેશદાર) પારુબેન દશરથભાઈ જાગાણિયા (સહ-દેશદાર)	ભોંયતિષ્યિ, આશાપુરા સોસાયટી, પાલનપુર- ડીસા રોડ, પ્લોટ નં.૯૩ પી પૂર્વ બાજુ, ડીસા બનાસકાંઠા ગુજરાત-૩૮૫પ૩૫ના તમામ હક્ક હિસ્સાઓ. સીમાઓઃ પૂર્વેઃ પ્લોટ નં.૯૨ની જમીન(બ્લોક નં.૭૮) પશ્ચિમેઃ પ્લોટ નં.૯૩ ની જમીન(બ્લોક નં.૮૦), ઉત્તરેઃ પ્લોટ નં. ૮૬ ની જમીન(બ્લોક નં.૭૪), દક્ષિણેઃ રોડ.	<u> 99-90-2023</u> <u>2-92,79,540 -</u>	505.R 00-05-
w	(લોન કોડ નં. ૦૩૫૦૦૦૦૫૭೯/ અમદાવાદ શાખા) સબ્બીર સુલેમાન સુક્ષાસરા (દેશદાર) સુક્રિયાબેન સબ્બીરભાઈ સુક્ષાસરા (સહ-દેશદાર), સુક્રીકઅહેમદ સુલેમાન સુક્ષાસરા (જામીનદાર)	ભિનખેત મિલકત નં. ૧૫૩ બી મુમનવાસ, ગ્રામ પંચાયત પાસે મોજે મજાદર વડગામ, બનાસકાંઠા, ગુજરાત-૩૮૫૨૧૦ના તમામ હક્કહિસ્સા. સીમાઓઃ પૂર્વેઃ માર્જિન એરિયા, પશ્ચિમેઃ રોડ, ઉત્તરેઃ સુજ્ઞાસરા હોજેફાની મિલકત, દક્ષિજ્ઞેઃ સુજ્ઞાસરા અલતાફની મિલકત.	<u>₹3-06-₹0₹3</u> ₹.e, ४ <sup>1</sup> 4, ४ e e  -	02-03-

આપકૃત આપકારા આધાર હાઉસિંગ કાઇનાન્સ લિ. તા. ૧૩-૦૨-૨૦૨૪



Regd. Office: 7th Floor, Hasubhai Chambers, Opp. Town Hall, Ellisbridge, Ahmedabad- 380006, Phone No. (O) 079-26574371/72/73, (F) 079-26574374, Email: info@kiriindustries.com website: www.kiriindustries.com

#### **Extract of Statement of Consolidated Financial Results** for the Quarter and Nine Months ended December 31, 2023

			(Rs. in Lakhs)	
	Quarter	Ended	Nine months Ended	
Particulars	(31/12/2023)	(31/12/2022)	(31/12/2023)	
	(Unaudited)	(Unaudited)	(Unaudited)	
Total income from operations	22,175.11	20,405.91	68,299.63	
Net Profit/ (Loss) for the period (before tax,			"	
exceptional and/or extraordinary items)	(2,770.46)	(3,094.61)	(6,622.75)	
Net Profit/ (Loss) for the period before tax			A.	
(after Exceptional and/or Extraordinary items)	(2,770.46)	(3,094.61)	(6,622.75)	
Net Profit/ (Loss) for the period after tax	22		7.5	
(after Exceptional and/or Extraordinary items)	(2,939.66)	(3,400.92)	(7,146.31)	
Total Comprehensive Income for the period	72.			
[Comprising Profit/(Loss) for the period (after tax)				
and Other Comprehensive Income (after tax)]	12,637.06	5,397.31	14,262.23	
Paid up Equity Share Capital	5,183.42	5,183.42	5,183.42	
Reserves (excluding Revaluation Reserve) as				
shown in the Audited Balance Sheet of the				
previous year.	52)	-	-	
Earnings Per Share (Face value of Rs. 10/- each)	-			
Basic:	24.38	10.42	27.52	
Diluted:	24.38	10.42	27.52	

	Quarter	Nine months Ended		
Particulars	(31/12/2023)	(31/12/2022)	(31/12/2023)	
STANDARD RESIDENCE	(Unaudited)	(Unaudited)	(Unaudited)	
Total income from operations	14,934.21	13,957.10	46,724.03	
Net Profit/ (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(2,986.85)	(3,612.40)	(6,719.34)	
Net Profit/ (Loss) for the period after tax(after Exceptional and/or Extraordinary items)	(2,900.87)	(3,585.72)	(6,443.00)	

- The above is an extract of the detailed Unaudited Quarterly Financial Results ("Results") filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full Financial Results are available on the website of Stock Exchanges (www.bseindia.com & www.nseindia.com) as well as on the Company's website (www.kiriindustries.com).
- 2. The Statutory Auditors of the company have carried out a "Limited Review" of the above results as per Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

3. The above Results were reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors at their meeting held on February 12, 2024.

By order of the Board of Directors of Kiri Industries Limited

Date: February 12, 2024 Manish Kiri Place: Ahmedabad **Chairman & Managing Director** 











